



RAN-1801130701040001

M.A. (Sem. - I) Examination November - 2025
Economics (Paper : EC-01) Industrial Economics

Time: 2 Hours]

[Total Marks: 50

સૂચના : / Instructions

- (1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી.
Fill up strictly the above details on your answer book.
- (2) પ્રશ્ન 1 ફરજિયાત છે.
Question 1 is compulsory.
- (3) જમણી બાજુ દર્શાવેલા અંક પ્રશ્નના ગુણ દર્શાવે છે.
Figure of the right indicate full marks of the questions.

Seat No.:

--	--	--	--	--	--

Student's Signature

પ્ર. 1. નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો :

(10)

1. ઔદ્યોગિક અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર જણાવો.
2. બહુરાષ્ટ્રીય કંપનીની વ્યાખ્યા આપો.
3. બજાર પ્રવેશની શરતો જણાવો.
4. જોડાણ (મર્જર) એટલે શું?
5. પેટીની વૃદ્ધિના અવરોધો જણાવો.

પ્ર. 2. ઔદ્યોગિક પેટીના વિવિધ પ્રકારો જણાવી, કોર્પોરેટ પેટીના લક્ષણો વિગતે ચર્ચો.

(13)

અથવા

- પ્ર. 2. અ. વસ્તુ વિભિન્નતા એટલે શું તેના લક્ષણો ચર્ચો.** (07)
બ. કદના આર્થિક લાભ અને ગેરલાભો ચર્ચો. (06)

પ્ર. 3. ઔદ્યોગિક સ્થાનિયકરણનો આલ્ફ્રેડ વેબરનો સિદ્ધાંત સમજાવો.

(13)

અથવા

- પ્ર. 3. અ. પેટીની વૃદ્ધિને અસર કરતા પરિબળો સમજાવો.** (07)
બ. ઔદ્યોગિક ઉત્પાદકતાને અસર કરતા પરિબળો સમજાવો. (06)

પ્ર. 4. ટૂંકનોંધ લખો (કોઈપણ બે)

(14)

1. ઔદ્યોગિક અર્થશાસ્ત્રના લક્ષણો
2. નવપ્રવર્તન
3. જોડાણ (મર્જર)ના પ્રકારો
4. પેટીની વૃદ્ધિનું મારીસનું મોડેલ.

ENGLISH VERSION

Q. 1. Answer the following questions in brief.

(10)

1. State the Scope of Industrial Economics.
2. Define Multinational Company.
3. State conditions for market entry?

4. What is Merger?
5. State the constraints to growth of the firm.

Q. 2. State the different types of industrial firms and discuss the features of corporate firms in detail. (13)

OR

Q. 2. (A) What is product differentiation and discuss its features. (07)

(B) Discuss the advantages and disadvantages of economies of scale. (06)

Q. 3. Explain Alfred Weber's theory of industrial- location. (13)

OR

Q. 3. (A) Explain the factors affecting the growth of a firm. (07)

(B) Explain the factors affecting industrial productivity. (06)

Q. 4. Write a short note. (Any two) (14)

1. Characteristics of Industrial Economics.
 2. Innovation.
 3. Types of Mergers.
 4. Maris's model of growth of the firm.
-